

Date: February 7, 2023

To, **BSE Limited**Phiroze Jeejeebhoy Towers,

Dalal Street,

Mumbai – 400 001.

Dear Sir,

Sub: Newspaper Clipping - Extra Ordinary General Meeting Notice dated February 28, 2023

Ref: Shish Industries Limited (Security Id/Code: SHISHIND / 540693)

Please find attached herewith the copy of newspaper notice informing about the Extra Ordinary General Meeting Notice / E-voting / Cut-off date as published in the requisite newspaper as per the requirement of Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Kindly take the same on your record

Thanking You,

Yours faithfully,

For, Shish Industries Limited

Vibha Khandelwal Company Secretary

Place: Surat

Date: February 7, 2023

Registered Office: TP No.4, RS No.11 Paiki, 12-13 B, Paiki Plot C

1st Floor of 11, 12 Suryapur Mill Compound, Varachha Road,

Surat-395006, Gujarat, India

Tel: +91 98251 90407 . Email: info@shishindustries.com

Web: www.shishindustries.com



ઓમકારા એસેટ્સ રિકન્ટ્રક્શન પ્રાઇવેટ લીમીટેડ રજીસ્ટર્ડ એફીસ : ૬, એમ.પી. નગર, પહેલો માળ, કુંગુ નગર એસરેન્શન, ઉપરુ-દૂષકૃજ કેપોરેટ એફીસ : સી/પવપ, કનકીયા જીલીયોન, બંકરાન ઓફ એલળીએસ રોડ એન્ડ સીએસટી રોડ, બીકેસી એન્ટ્રેસી, એક્સીનોન્ક્સ પારે, કુર્લા

માંગણા નોટીસ

સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાંચનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (એક્ટ) ની કલમ ૧૩(૨) હેઠળ

તમો નીચે જણાવેલ દેવાદારો , સહ–દેવાદારો, જામીનદારો/ગીરવેદારોએ નીચે જણાવેલ મિલકત/તોના ગીરો દ્વારા ઇન્ડસઇન્ડ બેંક લીમીટેડ પાસેથી નાણાંકિચ સહાયો લીધી હતી. આ ઉપરાંત તેની પરત ચુકવણીના કસુરોના પગલે લોન એકાઉન્ટ ઇન્ડસ ઇન્ડ બેંક લીમીટેડ દ્વારા નોન–પરફોમિંગ એસેટ્સ તરીકે ઘોપીત કરાચા હતા. ઔરીજનલ લેન્ડરે અસાઇનમેન્ટ એગ્રીમેન્ટ તારીખ રપ જુન ૨૦૨૧ દ્વારા **ઓમકારા પીએસ૦૬/૨૦૨૧–૨૨** ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેની ક્ષમતામાં કાર્ચરત ઓમકારા એસેટ્સ રીકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ જ્યુરન **ાંત્રાના આવેલા કુલ્યુરના વિસ્તૃર** કરો કરો હતા કુલ કરો હતા તે કહેવા હતા હતા કરો છે. અને કાર્ય અરફિલ દારુંન્ટ જોડા પ્રિટિવ લિન લાસી એક એક કે એક એક એક એક એક કે કર્યાવલે છે ! ને નીચે જણાવેલ લેન્ડરના તમામ હકો ઓએઆરપીએલને તળદીલ કરાચેલ છે. ઓએઆરપીએલ હવે જણાવેલ લોન એકાઉન્ટોના સંબંધમાં સિક્ચોર્ડ લેણદાર છે. ઓએઆરપીએલ જણાવેલ લોન એકાઉન્ટોમાં બાકી રહેલ રકમની વસુલાત માટે સરફૈસી એક્ટને જોગવાઇઓ હેઠળ કાર્યવાહી આગળ વધારવા માટે તમામ સત્તા, પ્રધિકારો, હકો અને ટાઇટલનો ઉપચોગ કર્યો છે. ઓએઆરપીએલે જણાવેલ એસાઇનમેન્ટ મુજબ અને એક્ટની કલમ ૧૩(૨) કેઠળ માંગણાં નોટીસ જારી કરી બાકી રકમની વસુલાત માટે નીચેના દેવાદારોને ઓરીજનલ લેન્ડર અને દેવાદાર(રો)/સંહ દેવાદારો/ગીરવેદાર(રા) વચ્ચે કરાયેલ લોન એગ્રીમેન્ટ્ર સાથે વંચાતા જણાવેલ દેવાદાર(રો) દ્વારા કરાયેલ અન્ય દસ્તાવેજો હેઠળ તેમને જારી કરાયેલ સંબંધિત માંગણા નોટીસમાં જણાવેલ ૨કમ પરત ચુકવવા જણાવેલ છે જેની વિગતો નીચે આપેલ છે :વાદાર/સહ–દેવાદાર/ગીરવેદારના નામ, લોન એકાઉન્ટ નંબર, કલમ ૧૩(૨) હેઠળ માંગણા નોટીસની તારીખ, માંગણા નોટીસમાં જણાવેલ ૨કમ અને ગીર મિલકતની વિગત નીચે મુજબ છે.

દેવાદાર/સહ–દેવાદાર/ ગીરવેદારનું નામ	લોન એકાઉન્ટ નંબર	કલમ ૧૩(૨) હેઠળ માંગણા નોટીસની તારીખ	કલમ ૧૩(૨) મુજબ જણાવેલ રકમ
શ્રી મુકેશભાઇ બલુભાઇ ધામેલિયા (દેવાદાર), શ્રી ભરતભાઇ બલુભાઇ ધામેલિયા (સહ-દેવાદાર), શ્રી બલુભાઇ જિવરાજભાઇ ધામેલિયા (સહ-દેવાદાર), શ્રીમતી અસ્મિતાબેન ભરતભાઇ ધામેલિયા (સહ-દેવાદાર), શ્રીમતી ધર્મિષ્ઠાબેન મુકેશબાઇ ધામેલિયા (સહ-દેવાદાર)ગીરવેદાર)	%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%	૨૮.૦૯.૨૦૨૨	રૂા. ૮૮,૪૪,૧૬૪.૭૧/–

ગીરો મિલકતની વિગત: મિલકત ૧: શોપ નં. ૩૫૧, ૩જો માળ, ક્ષેત્રફળ ૧૩.૯૪ ચો.મી., કાર્પેટ એરિયા તેમજ અવધ વાઇસરોયની જમીનમા ન વહેચાચેલ હિસ્સો, બ્લોક નં. ૧૪૭, ૧૪૬–એ, કાઇનલ પ્લોટ નં. ૫૬/૧ અને ૬૦, ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. ૨૧ (સરથાણ સિમાડા), મોજે ગામ સરથાણાં, તાલુકો ચોર્ચાસી, જિલો સુરત ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુઃસીમા ફાઇનલ પેલનંટ નં. ૬૧/૨/એ અને ૬૧/૨/બી, પશ્ચિમ: રોડ, ઉત્તર: ૬૦ મીટર રોડ, દક્ષિણ: ૧૮ મીટર રોડ. **મિલકત ૨**: રેસીડેન્સીચલ મુલો પ્લોટ નં. ૭૭, જમીન એરિયા ક્ષેત્રફળ દ્દ.૮૯ ચો.મી., તેમજ ન વહેચાચેલ હિસ્સો ૩.૭૫ ચો.મી., શિવ દર્શન તરીકે <mark>જા</mark>ણીતી સ્કીમમાં, બ્લોક નં. ૩૨૯, (જુનો રેવન્યુ સર્વે નં. ૩૪૮), મોજે કામરેજ, તાલુકો કામરેજ, જિલો સુરત ખાતેની સ્થાવર મિલકતન તમામ ભાગ અને હિસ્સા. ચતુઃસીમાઃ પુર્વઃ રોડ, પશ્ચિમઃ પ્લોટ નં. ૭૮, ઉત્તરઃ પ્લોટ નં. ૭૬, દક્ષિણઃ સોસાચટીનો રોડ.

ાત્રામાં ભાગ છેળાં ભારતા. ઘપું સાત્રા, યુવા સહ, પારસન, પ્લાર, ના, છે, છાદા મારે અને છે, દારાણા સાલાયા મારે આથી આથી દેવાદારા (સે)/સહ-દેવાદારો/જામીનદારો /ગીરવેદારોને આ નોટીસની તારીખથી દૃંગ દિવસની અંદર ઉપર બણાવેલામાં આવે છે, જેમાં નિષ્ફળ બતા નીચે સહી કરનારને ઉપર બણાવેલ સિક્સોરીટીને ટાંચમા લેવા માટે એક્ટ હેઠળ કારોવાહી કરવાની ફરજ પડશે. નોંધ લેવી કે જણાવેલ એક્ટની કલમ ૧૩(૧૩) હેઠળ તમોને ઓએઆસીએલની આગોતરી લેપીતા મંબૂરી વગર વેચાણ, ભારે આવવા અન્ય રીતે ઉપર બણાવેલ મિલકતીની તબદીલી કરવા મનાઇ ફરવામાં આવે છે. એક્ટ અથવા તે હેઠળ રચાચેલ જોગવાઇઓનું ઉલંદાન કરનાર અથવા ઉલંદાનમાં સહાય કરનાર કોઇપણ વ્યક્તિ એક્ટ હેઠળ નિયત જેલ અને/અથવા દંડને પાત્ર બનશે.

ારીખ : ૦૩.૦૨.૨૦૨૩ થળ : સુરત ગુજરાત

ઓમકારા એસેટ્સ રિકન્ટ્રક્શન પ્રાઇવેટ લીમીટે ઓમકારા પીએસ૦૬/૨૦૨૧–૨૨ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેની ક્ષમતામાં કાર્યર

Edelweiss

પરિશિષ્ટ ૪ (જુઓ નિયમ –૮ (૧) કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

આથી, એડેલવેઇઝ એસેટ રીકન્સ્ટક્શન કંપની લીમોટેડ (ઇએઆરસી ટ્રસ્ટ એસસી–૪૪૪ ના ટ્રસ્ટી તરીકે તેની ક્ષમતામા કાર્યરત) (ઇએઆરસી/સિક્ચોર્ડ લેણદાર)ન નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇ)જ્ઞેશન અને રીકન્સ્ટુક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ (૨૦૦૨ના ૫૪)(સરફૈરી એક્ટ) ની કલમ ૧૩(૨)ની જોગવાછઓ સાથે વંચાતા સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ (નિયમો)ના નિયમ ૩ સાથે વાંચ હેઠળ તારીખ ૧૭ નવેમ્બર, ૨૦૨૨ ના રોજ માંગણા નોટીસ જારી કરી (૧) રાઘવ કોન્પ્રો એલએલપી (દેવાદાર), (૨) શ્રી કમલેશભાઇ કે ગોંડલીયા અને (૩) રાજેશકુમા કે ગોંડલીચા (જામીનદારો) ને માંગણા નોટીસમાં જ્ણાવેલ કુલ રકમ ગ્ન. ૨૭,૭૦,૬૭,૦૬૬/– (રૂપિયા સત્યાવીસ કરોડ સિત્તેર લાખ સડસઠ હજાર છાસઠ પુરા) ૦૫ નવેમ્પ્ય ૨૦૨૨ મુજબની બાકી રકમ તેમજ કરારના દરે ચડત વ્યાજ અને તેના પરના અન્ય ચાર્જિસ આ નોટીસ મળ્યાની તારીખથી દ૦ દિવસની અંદર ચકવવા જણાવ્યં હત દેવાદારો ઉપર જણાવેલ બાકી રકમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથઇ દેવાદાર, જામીનદારો અને જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ બેંચમો, ૨૦૦૨ ના નિયમ ૮ સાથે વંચાતી સરફૈસી એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયો કરીને અહીં નીચે જણાવેલ સિક્યોર્ડ મિલકતો સાંકેતિક કબજો ૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ લઇ લીધો છે.

ખાસ કરીને દેવાદાર અને જામીનદારો અને જાહેર જનતાને આથી નીચે જણાવેલ સિકચોર્ડ મિલકત સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલક્ત સાથેનો કોઇપણ સોદો સિક્યોર્ડ લેણદાર એટલે કે ઇએઆરસીની રકમ રૂા. ૨૭,૭૦,૬૭,૦૬૬/ (રૂપિયા સત્યાવીસ કરોડ સિત્તેર લાખ સડસઠ હજાર છાસઠ પુરા) ૦ નવેમ્બર, ૨૦૨૨ મજબની બાકી રકમના ચાર્જને આદ્યન રહેશે.

સિક્ચોર્ડ એસેટો પરત મેળવવા માટે ઉપલબ્ધ સમચના સંબંધમાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮)ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે

સિક્ચોર્ડ મિલકતોની વિગત

તક્ષશીલા મેટ્રો ઇન્ડસ્ટ્રીચલ પાર્ક (પ્રોજેક્ટ)માં નીચેના ન વહેચાચેલ ચુનિટોમાં રાઘવ કોન્પ્રો એલએલપીના તમામ હકો, ટાઇટલ અને હિત:–

ક્રમ નં.	યુનિટ નં.	પ્રકાર	બાંધકામ વેચાણ એરિયા	ખુલી જમીનનું વેચાણ	વહેંચાચેલ કુલ એરિયા	બાંદ્યકામ કાર્પેટ એરિયા
			(ચો. ફુટ)	એરિયા (ચો. ફુટ)	(ચો. ફુટ)	(ચો. ફુટ)
٩	પી૧-૦૨	શેડ	રપર૯	чхо	30 ξ G	9366.44
5	પી૧–૦૭	શેડ	રપર૯	чүо	30ξС	9366.44
3	પી૧-૦૮	શેડ	રપરલ	чхо	3086	9366.44
٧	પી૧–૧૪	શેડ	રપરલ		રપર૯	9366.44
ч	પી૧–૧૭	શેડ	રપરલ		રપર૯	9366.44
ξ	પી૧–૧૮	શેડ	રપરલ		રપર૯	9366.44
9	પી૧–૧૯	શેડ	રપર૯		રપર૯	9366.44
۷	પી૧–૨૦	શેડ	રપર૯		રપર૯	9366.44
C-	પી૧–૨૨	શેડ	રપર૯		રપર૯	
٩o	પી૧–૨૩	શેડ	રપર૯		રપર૯	9366.44
99	પી૧–૨૪	શેડ	3094	૧૫૭૫	хчео	૧૬૫૨.૦૬
૧૨	પી૧–૪૩	શેડ	6 ξ3		6 ξ3	૫૧૫.૭૩
93	પી૧–૭૬	શેડ	૨૫૬૫		૨૫૬૫	93.55%
૧૪	પી૧–૭૭	શેડ	રપદ્દપ		રપદ્દપ	૧૪૨૨.૯૯
૧૫	પી૧–૭૮	શેડ	૨૫૬૫		૨૫૬૫	૧૪૨૨.૯૯
૧૬	પી૧–૮૨	શેડ	૨૫૬૫		૨૫૬૫	93.5589
૧૭	પી૧-૮૩	શેડ	૨૫૬૫		૨૫૬૫	93.5589
٩८	પી૧-૮૫	શેડ	૨૫૬૫		૨૫૬૫	99.556
96	પી૧-૮૬	શેડ	૨૫૬૫		રપદ્દપ	93-5-66
50	પી૧–૯૨	શેડ	રપદ્દપ	чхо	3904	93.55%
૨૧	પી૧–૯૩	શેડ	૨૫૬૫	чхо	3904	93.5589
રર	પી૧–૯૮	શેડ	રપદ્દપ	чхо	3904	૧૪૨૨.૯૯
£3	પી૧–૧૦૦	શેડ	રપદ્દપ	чхо	3904	93.5589
58	પી૧–૧૦૧	શેડ	રપદ્દપ	чүо	3904	99.55%

પ્લોટ નં. ૪૭૨ ક્ષેત્રફળ ૨૯૬૯.૩૭ ચો.મી. ખાતેની ફીહોલ્ડ પ્રોજેક્ટ જમીન પરના તમામ અને ભાગ હિસ્સા પર બંધાયેલ શેડ નં. એ-૧/૪૭૩, તેમજ જમીન ક્ષેત્રફળ ૩૦૨૦.૦૦ ચો.મી., શેડ નં. એ-૧ ૪૭૪ તેમજ જમીન ક્ષેત્રકળ ૨૭૭૫.૩૮ ચો.મી. અને શેડ નં. એ-૧/૪૭૫ તેમજ જમીન ક્ષેત્રકળ ૨૭૭૬ ચો.મી., ગુજરાત ઇન્ડસ્ટીયલ ાલોપમેન્ટ કોર્પોરેશનના ાટવા ઇન્ડસ્ટ્રીચલ એસ્ટેટ (ફેઝ–૨)માં, મોજેવિઝોલ, તાલુકો વટવા (જૂનો અમદાવાદ સીટી– પૂર્વ)જિશે અમદાવાદ અને પેટા જિશે અમદાવા ૧ (અસલાલી), ગુજરાત ખાતે આવેલ મિલકત તેમજ પ્રોજેક્ટ અને ચુનિટને સંબધિત રાઘવ કોન્પ્રો એલએલપી ની જંગમ મિલકતો તેમજ તેની મશીનરીઓ,ઉપકરણઓ મશીનરી સ્પેર્સ, ટુર્લ્સ અને એસેસરીઝ અને તેના પર રહેલ વર્તમાન અને ભાવી તમામ અન્ય જંગમ મિલક્તો.

તારીખ: ૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૩

સ્થળ: અમદાવાદ

અધિકૃત અધિકાર્ર એડેલવેઇઝ એસેટ રીકન્સ્ટક્શન કંપની લીમીટેડ (ઇએઆરસી ટ્રસ્ટ એસસી-૪૪૪ ના ટ્રસ્ટી તરીકે તેના ક્ષમતામાં કાર્ચરત)





ADITYA BIRLA FINANCE LIMITED

રજીસ્ટર્ડ ઓફિસ : ઇન્ડિયન રેયોન કમ્પાઉન્ડ, વેરાવળ, ગુજરાત - ૩૬૨૨૬૬, CIN : U65922GJ2009PLC083779 કોર્પોરેટ ઓફિસ : આર-ટેક પાર્ક, દસમો માળ, નિર્લોન કોમ્પ્લેસ, ઓફ વેસ્ટર્ન એક્સપ્રેસ વે, ગોરેગાંવ પૂર્વ - મુંબઇ - ૪૦૦૦૬૩. કલમ ૧૩(૨) સરફેસી એક્ટ - ૨૦૦૨ હેઠળ ડીમાન્ડ <u>નોટીસ</u>

આથી નીચે જણાવેલ બાકીદારે શિડયુલ ઉલ્લેખિત મિલકતને ગીરો મારફતે લોન લીધી છે અને અમે નીચે જણાવેલ લોન કરાર માટે બાકીદાર / સહ-બાકીદાર / જામીનદાર/મોર્ગેજર તરીકે છો. તમામ ક્રારા કરાયેલા ડિફોલ્ટરોને પરિણામે, તમારા લોન ખાતેને સિક્યુરીટાઈઝેશન એન્ડ રીકસ્ટ્રકશન ઓફ

ફાઈનાન્શિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એકટ, ૨૦૦૨ (સરફેસી એકટ) ની જોગવાઈઓ હેઠળ બીન - કાર્યકારી સંપત્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અમે આદિત્ય બિરલા ફાઈનાન્સ લિમીટેડ તમારા દ્રારા આપેલા સરનામાં પર સરફેસી એકટની કલમ ૧૩(૧૩) સાંથે વાંચેલી કલમ૧ ૩(૨) હેઠળ ડિમાન્ડ નોટીસ જારી કરી હતી. આ નોટીસની વિગતોએ છે કે તમે ગેરંટી આપવામાં આવેલી વિવિધ લોનની ચુકવણીમાં તમોએ ડિફોલ્ટ કરેલ છે. તેથી વર્તમાન પ્રકાશન દ્રારા સરફેસી અધિનિયમની કલમ ૧૩(૨) ની જોગવાઈઓ અને સિકયુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ ના નિયમ ૩(૧) ની જોગવાઈના સંદર્ભમાં નોટીસ આપવામાં આવે છે.

લોન એકાઉન્ટ નં./નામ અને એકાઉન્ટનું સરનામું,	ડીમાન્ડ નોટીસ	ડિમાન્ડ નોટીસ
બાકીદાર(રો), સહ-બાકીદાર(ઓ) અને જામીનદાર(રો)	ની તારીખ	મુજબની બાકી રકમ
(Loan Account No. HCFAH2TER00001000140) (૧). ગંગોત્રી ટ્યુબ (ઉદારક્તા), પ, વકીલ એસ્ટેટ, પુષ્પાંજલી સ્કુલ પાસે, મહાદેવ એસ્ટેટ પાછળ, રામોલ, અમદાવાદ, ગુજરાત - ૩૮૨૪૪૯, (૨). ચોગેશ શાંતારામ પાટીલ (મોર્ગેજર / જામીનદાર), ઓ-૧૦૪, પરિષ્કર - ૨, ખોખરા સર્કલ, મણીનગર, અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૦૮, (૩). રૂપલ ચોગેશ પાટીલ (મોર્ગેજર / જામીનદાર), ઓ-૧૦૪, પરિષ્કર - ૨, ખોખરા સર્કલ, મણીનગર, અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૦૮, (૪). રાજેશકુમાર શાંતારામ પાટીલ (મોર્ગેજર / જામીનદાર), ઓ-૧૦૪, પરિષ્કર - ૨, ખોખરા સર્કલ, મણીનગર, અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૦૮, (૪). અંગેજર / જામીનદાર), ૭૦, વિજયપાર્ક સોસાયટી, ગોર નો કુવા પાસે, ચેલરમાતાના મંદિર પાસે, અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૦૮, (૬). નિલિમા રાજેશભાઈ પટેલ (મોર્ગેજર / જામીનદાર), ઓ-૧૦૪, પરિષ્કર - ૨, ખોખરા સર્કલ, મણીનગર, અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૦૮.	30.0૧.૨૦૨૩ એનપીએ ની તારીખ ૦૪.૧૦.૨૦૨૨	રૂા. ૧,૨૬,૩૬,૫૩૫.૯૧ (રૂા. એક કરોડ છવ્વીસ લાખ છત્રીસ હજાર પાંચસો પાંત્રીસ અને એકાણું પૈસા) તા. ૨૪.૦૧.૨૦૨૩ સુધીની બાકી રકમ

અમલમાં મુકલામાં આવનારી સુરક્ષિત મિલકતની વિગતો:

મિલકત નં. ૧ ઃ- તમામ ભાગ અને હિસ્સા સાથેની રહેણાંક ફલેટ થી જાણીતો ફલેટ નં. ૧૦૪, ક્ષેત્રફળ ૧૨૦૨ સ્કે.ફીટ., પહેલો માળ, બ્રોસર મુજબ બ્લોક નં. ઓ અને બ્લોક નં. કયુ, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન મુજબ થયેલ પ્લાન મુજબ, પરિષ્કાર - ૨ થી જાણીતી સ્કીમ, ખાનગી સબ પ્લોટ નં. ૩ એડમીની લીઝ હોલ્ડ જમીન પર બાંધવામાં આવેલ, ક્ષેત્રફળ ૨૩,૬૨૮ સ્કે.મી., (અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન મુજબ થયેલ પ્લાન મુજબ સન પ્લોટ નં. ૨) એફ.પી. નં. ૩૧, પૈકી 1/3^ત અવિભાજીત હકક સાથે, તમામ હકક અને હિસ્સા સાથેના આંતરીક એપ્રોચ રોડનું ક્ષેત્રફળ ૧૦,૬૦૦ સ્કે.મી., ટી.ી. સ્કીમ નં. ૭ (ઓઢવ), રજીસ્ટ્રેશન જીલ્લો - અમદાવાદ. **ચતુઃસીમા :- ઉત્તરે** : ફલેટ નં. ઓ/૧૦૩, **દક્ષિણે** : રોડ, **પૂર્વે** : ફલેટ નં. ઓ/૧૦૧, **પશ્ચિમે** : આંતરીક રોડ અને પાર્કીગ. આ સાથે જોડાયેલ સરળતાઓ સાથે અને એક સાથે તમામ ઈમારતો અને બાંધકામો ઉભા છે અને તેના પર બાંધવામાં આવશે અને તમામ ફિટીંગ, ફિક્સર, પ્લાન્ટ અને મશીનરી જમીન સાથે જોડાયેલ છે અથવા જમીન સાથે જોડાયેલ કોઈપણ વસ્તુ સાથે કાયમ માટે જોડાયેલ છે, વર્તમાન અને ભવિષ્ય બંને.

મિલકત નં. ૨ : તમામ ભાગ અને હિસ્સા સાથેની ઈન્ડસ્ટ્રીયલ મિલકત શેડ નં. ૨૮, ક્ષેત્રફળ ૧૩૨.૩૭ સ્કે. યાર્ડ. બાંધકામ સાથે, ધનલક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટથી જાણીતું, બાંધકામનો ટીપી સ્કીમ નં. ૧૪, એફ.પી. નં. ૯૮, ૯૯/૧, ૯૯/૨ અને ૧૦૦, સી.એસ. નં. ૨૩૧૩, મોજે દરીયાપુર - કાઝીપુર, સબ જીલ્લો - અમદાવાદ - ૬ (નરોડા), રજીસ્ટ્રેશન જીલ્લો - અમદાવાદ. **ચતુઃસીમા :- ઉત્તરે** : શેડ નં. ૨૯, **દક્ષિણે** : ખુલ્લી જમીન, **પૂર્વે** : શેડ નં. ૨૭, પશ્ચિમે : સોસાયટી રોડ. આ સાથે જોડાયેલ સરળતાઓ સાથે અને એક સાથે તમામ ઈમારતો અને બાંધકામો ઉભા છે અને તેના પર બાંધવામાં આવશે અને તમામ ફિટીંગ, ફિકસર, પ્લાન્ટ અને મશીનરી જમીન સાથે જોડાયેલ છે અથવા જમીન સાથે જોડાયેલ કોઈપણ વસ્ત સાથે કાયમ માટે જોડાયેલ છે. વર્તમાન અને ભવિષ્ય બંને.

આ નોટીસના પ્રકાશનની તારીખ થી ૬૦ દિવસની અંદર વ્યાજ અને ખર્ચ સાથે ઉપરોક્ત રકમ ચુકવવા માટે આદિત્ય બિરલા ફાઈનાન્સ લિમીટેડ દ્રારા જાણ કરવામાં આવે છે. અન્યથા આદિત્ય બિરલા કાઈનાન્સ લિમીટેડ આ કાયદાની જોગવાઈઓ હેઠળ જરૂરી કાર્યવાહી કરશે. બાકીદારો. ગીરો અને જામીન આપવાનાઓની સુરક્ષીત સંપત્તિનો કબજો લેવા સહિત તમામ અથવા કોઈપણ એક અથવા વધુ સુકક્ષિત સંપત્તિ. આ અધિનિયમ હેઠળ આદિત્ય બિરલા ફાઈનાન્સ લિમીટેડને મળેત સત્તાઓ આ મુજબ છે (૧) બાકીદારો / જામીનદારોની સુરક્ષીત સંપત્તિનો કબજો લેવાની સત્તા, જેમાં લીઝ દ્રારા ટ્રાન્સફર કરવાના અધિકારો, સુરક્ષિત સંપત્તિ મુકત કરવા માટે વેચાણની સોંપણી (૨) લીઝ, સોંપણી અથવા વેચાણના માધ્યમથી ટ્રાન્સફર કરવાના અધિકારો સહીત સુકક્ષિત અસ્કયામતોનું સંચાલન હાથમાં લેવુ અને સુરક્ષિત મિલકતોની અનુભૂતી કરવી અને આદિત્ય બિરલા ફાઈનાન્સ લિમીટેડ દ્રારા સુકક્ષીત સંપત્તિ તરીકે કોઈપણ ટાન્સકર તમામ હકકો અને સંબંધિતના સંબંધમાં રહેશે. તે તમામ દ્રારા ટાન્સકર કરવામાં આવેલ છે તેમ માનવામાં આવશે. ઉપરોક્ત અધિનિયમની કલમ ૧૩(૧૩) ની જોગવાઈઓના સંદર્ભમાં. તમને આથી વેચાણ. લીઝ અથવા અન્યથા (તમારા વ્યવસાયના સામાન્ય અભ્યાસક્રમ સિવાય), કોઈપણ સરક્ષીત સંપત્તિને સ્થાનાંતરીત કરવા પર પ્રતિબંધ છે.

તારીખ : ૦७.૦૨.૨૦૨૩ ક્ષળ : અમદાવાદ

નોંધ : (વિવાદ ની સ્થિતીમાં અંગ્રેજી આવૃતિને માન્ય રાખવામાં આવશે) આદિત્ય બિરલા ફાઈનાન્સ લિમીટેડ

અધિકૃત અધિકારી,

Punjab Logistics Infrastructure Limited

WALK-IN-INTERVIEW Punjab Logistics Infrastructure Ltd. (PLIL), a J.V. Company of CONCOR (Navratna PSU under Ministry of Railways), and PSWC Ltd. (Wholly Owned State Govt. Company) has set

up a Multi Model Logistics Park in Ahmedgarh, Ludhiana (Punjab). The company desirous to hire following candidates on contract basis initially for a period of 03 years, extendable

1) Chief Financial Officer (CFO): Qualified CA with one year experience, on the consolidated pay of Rs. 75,000/- per month for 1 $^{\rm st}$ year, Rs. 80,000/- p.m. for 2 $^{\rm st}$ year and Rs. 85,000/- p.m. for 3 $^{\rm st}$ year. 2) Assistant Chief Financial Officer (ACFO): B.Com graduate and a C.A./CMA/ICW/

Inter both groups cleared with one year experience on the consolidated pay of Rs. 35,000/ per month for 1st-year, Rs. 38,500/- p.m. for 2rd year and Rs. 42,000/- p.m. for 3rd year, Walk-in-interviews shall be conducted on **24/02/2023** from **11:00 AM** onwards at Ludhiana (PB). For further details i.e. Venue, Educational Qualification, Experience, Remuneration other benefits etc., please see our website www.plil.co.in.

લોડેંઝ ઇશ્વર હોટલ્સ લીમિટેડ

રજી.ઓ.હોટલ રિવાઇવલ, સયાજી ગાર્ડન પાસે, કોલાઘોડા ચોક, યુનીવર્સીટી રોડ, વડોદરા. ગુજરાત ૩૯૦૦૦૨ ટેલિ.: ૦૨૬૫ ૨૭૯૩૫૪૫ CIN: L55100GJ1985PLC008264 ઇમેઇલ: info@lordsishwar.com, વેષ: www.lordsishwar.c **૩૧મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પૂરા શતા ત્રિમાસિક સત્ર અને નવ મહિનાના અનઓડિટેડ** એકલ નાજ્ઞાંકીય પરિજ્ઞામોનો ઉતારો ત્રિમાસિક સત્ર | વવ મહિનાના | ત્રિમાસિક

વિગતો	ાત્રમાસિક સત્ર અંતે	નવ માહનાના અંતે	ાત્રમાસિક સત્ર અંતે
143101	39.92.2022	39.92.2022	39.92.2029
	(અનઓડિટેડ)	(અનઓડિટેડ)	(अनओडिटेड)
કામગીરીથી કુલ આવક	૩૨૭.૦૫	૫૪૦.૬૯	२०८.०१
સમયગાળા માટે ચોખ્ખો નકો/(નુકસાન)(કરવેરા અપવાદરૂપ અને/અથવાઅસાધરણ વસ્તુઓ પહેલાં)	૧૭.૨૭	૨૮.૫૬	४.૧૭
સમયગાળા માટે ચોખ્ખો નફો/(નુકસાન)કરવેરા પહેલાં (અપવાદરૂપ અને/અથવા અસાધારણ આઇટમ પછી)	૧૭.૨૭	૨૮.૫૬	४.৭৩
સમયગાળા માટે ચોખ્ખો નફો / (નુકસાન) કર બાદ (અપવાદરૂપ અને/ અથવા અસાધારણ વસ્તુઓ પછી)	15.80	२०.७३	(૧૦.૪૫)
કુલ વ્યાપક આવક સમયગાળા માટે (જેમાં નફો / (નુકસાન) સમયગાળા માટે (કર બાદ) અને અન્ય વ્યાપક આવક(કર બાદ)	15.80	२०.७उ	(૧૦.૪૫)
ઇક્વિટી શેર મૂડી	9४9.00	9४9.00	9४9.00
અનામત (પુન:મુલ્યાંકન સિવાય રિઝર્વ તરીકે પાછલા બેલેન્સ શીટમાં બતાવ્યા પ્રમાણે)			
શેરદીઠ આવક (દરેકના રૂા. ૧૦/-)(ચાલુ અને બંધ કામગીરીથી)			
૧. મૂળભૂત	0.22	0.26	(o.98)
૨. ભળેલા	0.22	0.2८	(o.98)

નોંધઃ ઉપરોક્ત ઉતારા સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડીસ્કલોઝર રિકવાયરમેન્ટસ) નિયમો ૨૦૧૫ના નિયમ ૩૩ મુજબ સ્ટોક એક્સચેન્જમાં દાખલ કરેલ ૩૧મી ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ ત્રિમાસિક સત્ર અને નવ ાહિનાના અનેઓડીટેંડ નાણાંકીય પરિણામો પ્રમાણે દર્શાવેલ છે. આ પરિણામોનું સંપૂર્ણ સ્વરૂપ સ્ટોક એક્સચેન્જ ની વેબસાઇટ www.hseindia.com અને કંપનીની વેબસાઇટ www.lordsishwar.com પર ઉપલબ્ધ છે.

લોડેંઝ ઇશ્વર હોટલ્સ લીમિટેડ વતી,

તારીખ : os ફેબ્રુઆરી, ૨૦૨૩ વહીવટી સંચાલક (DIN: ०००८**९**३४३)



શીશ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

સી.આઇ.એન.: એલરપર૦ેલ્ઝુજેર૦૧૭પીએલસી૦૯૭૨૭૩ **રજીસ્ટર્ડ ઓફિસ**: ટીપી નંબર ૪, આરએસ નં. ૧૧ પૈકી, ૧૨–૧૩ બી પૈકી, પ્લોટ સી, પહેલો માળ, ૧૧, ૧૨ સૂર્યપુર મિલ કમ્પાઉન્ડ, વરાછા રોડ, સુરત-૩૯૫ ૦૦૬. ગુજરાત, ભારત દેલિફોન : +૯૧ ૨૯૧ ૨૫૫ ૦૫૭૯, વેબસાઈટ: www.shishindustries.com; **ย-มิย์ต**: compliance@shishindustries.com

કંપનીની સામાન્ય મીટિંગની સૂચના, બુક બંધ, નક્કી કરેલી તારીખ અને ઇ-મતદાનની સૂચના

આથી સૂચના આપવામાં આવે છે કે કોઈ એક સ્થળે સભ્યોની શારીરિક ફાજરી વિના વિડિયો સંગઠન (VC) અથવા અન્ય ઓડિયો વિડિયો માધ્યમ (OAVM) દ્વારા સામાન્ય સભા યોજવા માટે કોર્પેરિટ બાબતોનું મંત્રાલય દ્વારા તારીખ ૮ મી એપ્રિલ ૨૦૨૦ ના રોજ જારી કરાયેલા સામાન્ય પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, તારીખ ૧૩ મી એપ્રિલ ૨૦૨૦ ના રોજ જાર્ર કરાચેલા સામાન્ય પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ અને તારીખ ૨૮ મી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ જારી કરાચેલા સામાન્ય પરિપત્ર નં. ૧૧/૨૦૨૨ પ્રમાણે શીશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (કંપની) ના સભ્યોની સામાન્ય સભા (ઈજીએમ) મંગળવારે તારીખ ૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૩ એ સવારનાં ૧૧:00 વાગ્યે ઈજીએમની સ્ચનામાં જણાવ્યા મુજબનાં ખાસ વ્યવસાચો નો વ્યવહાર મંજૂર કરવા માટે VC/0AVM દ્વારા ચોજવામાં આવશે.

વ્યવસાર મેક્સ્કરના માટે **પછ**ે **પ્રમાના** હાર્કા માં વાવરા. ઉપર જણાવેલા કોર્પોરેટ બાબતોનું મંત્રાલય નાં પરિપત્રો પ્રમાણે અને સેબી દ્વારા તારીખ ૧૩ મી મે, ૨૦૨૨ ના રોજ જારી કરાચેલ પરિપત્ર નં. સેબી/એચઓ/સીએફડી/સીએમડીર/સીઆઈઆર/પી/ ૨૦૨૨/૬૨, ઈજીએમની સ્**ચના** ફક્ત તે જ સભ્યોને ઇલેક્ટ્રોબિક માધ્યમ દ્વારા મોકલવામાં આવી રફી છે, જેમના ઇમેઇલ સરનામાંઓ કંપની / ડિપોઝિટરીઝમાં શુક્રવાર તારીખ શુક્રવાર, 3 કેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ નોંધાયેલા છે. સભ્યોને નોંધ લેવા વિનંતિ છે કે ઈજીએમની સ્**યના કંપનીની વેબસાઇટ** www.shishindustries.com પર, બીએસઈ લિમિટેડની વેબસાઇટ www.bseindia.com પર અને નેશનલ સિક્થોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) ની વેબસાઇટ www.evoting.nsdl.com પર પણ મુકવામાં આવ્યા છે.

ઉપર જણાવેલા કોર્પોરેટ બાબતોનું મંત્રાલય નાં પરિપત્રો પ્રમાણે એ બધા સભ્યો કે જે ડીમેટ સ્વરૂપમાં અથવા ભૌતિક સ્વરૂપમાં કંપનીના ઇક્વિટી શેર ધરાવે છે અને પોતાનાં ઇ-મેઇલ સરનામાં નથી નોંધાવ્યા જેના લીધે ઈજીએમની સૂચના નથી મોકલી શકાઇ એ સભ્યો અસ્થાયીરૂપે તેમના ઇ-મેઇલ સરનામાં કેંપની સાથે આ પ્રમાણે નોંધાવી શકે છે, (એ) જો ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવો છો તો શેરધારકનું નામ, શેર પ્રમાણપત્રની સ્કેન કરેલી નકલ (આગળ અને પાછળ), પાન (પાનકાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી નકલ), આધાર (આધારકાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી નકલ) compliance@shishindustries.com પર ઇ-મેઇલ કરી ને, (બી) જો ડીમેટ સ્વરૂપમાં ધરાવો છો તો નામ, DPID-CLID (16 અંકનો DPID + CLID અથવા 16 અંકોના લાભાર્થી ID), ક્લાયંટ માસ્ટર અથવા કન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટની નકલ, પાન (પાનકાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી નકલ), આધાર (આધારકાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી નકલ) compliance@shishindustries.com પર ઇ-મેઇલ કરી ને, 3) અથવા તો સભ્યો પોઈન્ટ (એ) અથવા (બી) માં જણાવેલ વિગતો ઇ-મેઇલ દ્વારા evoting@nsdl.co.in પર મોકલીને યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવા માટે વિનંતી કરી શકે છે.

ઇ-મેઇલ સરનામાંની સકળ નોંધણી પછી. સભ્ય ને ઈજીએમ સંદર્ભે ઈજીએમની સચના ની ઇલેક્ટ્રોનિક નકલો, યુઝર આઇડી અને પાસવર્ડ અને ઇલેક્ટ્રોનિક મતદાન માટેની પ્રક્રિયા તેમને ઇલેક્ટ્રોનિક મતદાન માટે સક્ષમ બનાવવા માટે મોકલવામાં આવશે. કોઈપણ પશ્ચીના કિસ્સામાં સભ્યો compliance@shishindustries com પર કંપનીને વિનંતી કરી શકે છે. શેરધારકોને વિનંતી છે કે તેઓ તેમની સંપૂર્ણ બેંક વિગતો અને ઇમેઇલ આઈડી નોંધણી / અપડેટ કરવા માટે તેમના ડિપોઝિટરી સફભાગીઓ, જેમની સાથે તેઓ ડિમટીરીયલાઇઝ્ડ સ્વરૂપમાં હિસ્સો ધરાવે છે, તેને જરૂરી દસ્તાવેજો આપી ને તેમના ડિમેટ ખાતાની જાળવણી કરે.

કંપનીમાં કોઈપણ શેરફોલ્ડરો ભૌતિક સ્વરૂપમાં ઇક્વિટી શેર ન ધરાવતાં ફોવાને કારણે, કંપનીના સભ્યોના રજિસ્ટર અને શેર ટ્રાન્સફર પુસ્તકો બંધ રહેશે નહીં. એ બધા સભ્યો કે જેમના નામ મંગળવારે, તારીખ ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ (નક્કી કરેલી તારીખ) ના રોજ કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ દ્વારા જાળવવામાં આવેલા સભ્યોના રજિસ્ટરમાં અને ડિપોઝિટરીઓ પાસેથી પ્રાપ્ત થયેલા લાભદાયી માલિકો દેખાય છે ફક્ત એ જ સભ્યો દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન અને સામાન્ય સભા નાં દિવસે ઇલેક્ટ્રોનિક મતદાન ની સુવિધાનો લાભ મેળવવાના હકદાર રહેશે.

કંપનીઓનો ધારો, ૨૦૧૩ ("ધારો") ની કલમો ૧૦૮ ની જોગવાઈઓ અને અન્ય લાગુ જોગવાઈઓને અનુસરીને અને કંપનીઓ (સંયાલન અને વહીવટ) નિયમો, ૨૦૧૪ (સમય-સમય પર સુધારેલા મુજબ) ("નિયમો) ના નિયમો ૨૦ ને સાથે વાંચીને અને સેબી (સ્ચિબદ્ધ જવાબદારી અને જાહેરાત આવશ્યકતાઓ) નિયમનો, ૨૦૧૫ (સેબી સ્ચિઓ નિયમો) ના નિયમન ૪૪ અને અન્ય લાગુ કાયદા અને નિયમો ધ્યાનમાં રાખીને, કેંપની તેના સભ્યોને ઇજીએમમાં વ્યવસાયોને વ્યવહાર કરવા માટે દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન અને સામાન્ય સભા નાં દિવસે ઇલેક્ટ્રોનિક મતદાન ની સુવિધા પ્રદાન કરી રહી છે. કંપનીએ તમામ સભ્યોને ઇલેક્ટ્રોનિક મતદાન ની સુવિધા આપવા માટે નેશનલ સિક્ચોરિટીઝ

ઉ પોઝિટરી લિમિટેડ ("એનએસડીએલ") સાથે કરાર કર્યો છે. સભ્યો નોંધી શકે છે કે દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન શનિવાર, ફેબ્રુઆરી ૨૫, ૨૦૨૩, નાં રોજ સવારનાં ૦૯:૦૦ વાગ્યા થી શરૂ થશે અને સોમવાર, ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ નાં રોજ સાંજનાં ૦૫:૦૦ વાગતાં (બંને દિવસો સહિત) પુર્ણ થશે. આ સમયગાળા દરમિયાન, એ બધા સભ્યો કે જેમના નામ નક્કી કરેલી તારીખ ના રોજ કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ દ્વારા જાળવવામાં આવેલા સભ્યોના રજિસ્ટરમાં અને ડિપોઝિટરીઓ પાસેથી પ્રાપ્ત થયેલા લાભદાયી માલિકો દેખાય છે ફક્ત એ જ સભ્યો દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાનની સુવિધાનો લાભ મેળવવાના હકદાર રહેશે અને આવા સભ્યો ઇલેક્ટોનિક રીતે પોતાનો મત આપી શકશે. ત્યારબાદ એનએસડીએલ દ્વારા દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન કરવા માટે ઇ-મતદાન મોડ્યુલ અક્ષમ કરવામાં આવશે. એકવાર સભ્ય દ્વારા ઠરાવ પર મત આપ્યા પછી, તે , તેણીને પછીથી બદલવાની અથવા કરીથી મત આપવાની મંજરી આપવામાં આવશે નહીં સામાન્ય સભા નાં દિવસે ઇલેક્ટોનિક મતદાન ની સવિધા આપવામાં આવશે. જે સભ્યોએ ઇજીએમ પહેલાં દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન દ્વારા પોતાનો મત આપ્યો છે તે પણ ઇજીએમ માં હાજર રહી શકે છે પરંતુ તેઓ ફરીથી મતદાન કરવાનો હકદાર રહેશે નહી. દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન / ઇલેક્ટ્રોનિક મતદાન માટેની વિગતવાર પ્રક્રિયા ઇજીએમ ની સુચનામાં આપવામાં આવેલી છે.

કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેરો ઇજીએમની સૂચના મોકલ્યા પછી મેળવે છે અને નક્કી કરેલી તારીખ પર ધરાવે છે, તે e v o t i n g @ n s d l . c o . i n અથવા compliance@shishindustries.com પર વિનંતી મોકલીને યુઝર આઇડી અને પાસવર્ડ અને ઇલેક્ટ્રોનિક મતદાન માટેની પ્રક્રિયા મેળવી શકશે. જો કે, જો તમે દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન માટે પફેલેથી જ એનએસડીએલ સાથે નોંધાયેલ છે, તો પછી તમે તમારા મત આપવા માટે તમારી હાલની યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકો છો. જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા છો, તો તમે www.evoting.nsdl.com પર ઉપલબ્ધ "પાસવર્ડ ભૂલી ગયા છો" વિકલ્પનો ઉપયોગ કરીને તમારો પાસવુર્ડ ફરીથી સેટ કરી શકો છો.

દુરસ્થ ઇલેક્ટ્રોનિક માધ્યમને લગતાં કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, તમે સભ્યો દ્વારા વારંવાર .. પુછાતા પ્રશ્નો (FAQs) નો સંદર્ભ લો અને www.evoting.nsdl.com ના ડાઉનલોડ વિભાગ પર ઉપલબ્ધ સભ્યો માર્ટ દ્વરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન વપરાશકર્તા માર્ગદર્શિકા અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ અને ૧૮૦૦ ૨૨ ૪૪ ૩૦ પર ફોન કરી શકો છો અથવા evoting@nsdl.co.in પર વિનંતી મોકલી શકો છો. સભ્યો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ પર શ્રીમતી વિભા ખંડેલવાલ, કંપની સચિવ અને પાલન અધિકારી, નો સંપર્ક પણ કરી શકે છે અથવા compliance@shishindustries.com પર ઇ-મેઇલ લખી શકે છે અથવા વધુ સ્પષ્ટતા માટે +૯૧ ૨૬૧ ૨૫૫ ૦૫૮૭ ક્રોન કરી શકે છે.

સભ્યો ફક્ત VC / OAVM સુવિધા દ્વારા સામાન્ય સભામાં ભાગ લઈ શકે છે. સામાન્ય સભામાં જોડાવા માટેની સૂચના સામાન્ય સભાની સૂચનામાં આપવામાં આવી છે. જો સભ્યો ને ઇજીએમમાં ભાગ લેવા સંબંધિત કોઈ પક્ષી અથવા સમસ્યાઓ છે, તો તમે evoting@nsdl.co.in પર ઇમેઇલ લખી શકો છો અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ ખને ૧૮૦૦ ૨૨ ૪૪ ૩૦ પર ફ્રોન કરી શકો છો. VC / OAVM દ્વારા ઇજીએમમાં ભાગ લેનારા સભ્યોની ગણતરી કંપનીઓનો ધારો, ૨૦૧૩ ની કલમ ૧૦૩ ફેઠળ કોરમની ગણતરીના હેતુ માટે કરવામાં આવશે. બોર્ડના આદેશ દ્વારા

તારીખ: 05/0૨/ ૨૦૨૩

શીશ ઇન્કસ્ટ્રીઝ લિમિટેડ

સતીશકુમાર માણીયા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નિયામક ઓળખ નંબર: ૦૨૫૨૯૧૯૧

ANAND RAYONS LIMITED

305-306, Jay Sagar Complex Opp. Sub Jail, Khatodra SURAT GJ 395002 IN Ph.: 0261-2635521 | Email: anandrayonsItd@gmail.com | Website: www.anandrayons.com

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER (₹in Lakhs

& NINE MONTHS ENDED DECEMBER 31, 2022

	Quarter Ended		Nine Month Ended
	31.12.2022	31.12.2021	31.12.2022
	(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)
Total Income from Operations (net)	7201.47	9445.67	25082.96
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	51.86	55.07	228.02
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	51.86	55.07	228.19
Net Profit / (Loss) for the period after tax (after- Exceptional and/or Entraordinary items)	51.86	55.07	228.19
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	51.86	55.07	228.19
Equity Share Capital	1498.47	1498.47	1498.47
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	•	-
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) 1. Basic 2. Diluted	0.35	0.37	1.52
	Total Income from Operations (net) Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (after-Exceptional and/or Entraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] Equity Share Capital Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) 1. Basic	Total Income from Operations (net) Total Income from Operations (net) Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (after-Exceptional and/or Extraordinary items) Total Comprehensive Income for the period (after tax) and Other Comprehensive Income (after tax)] Equity Share Capital Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) 1. Basic 2. Diluted	Total Income from Operations (net) Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (after-Exceptional and/or Extraordinary items) Total Comprehensive Income for the period (after tax) and Other Comprehensive Income (after tax)] Equity Share Capital Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) 1. Basic 0.35 0.37

1. The above is an extract of the detailed format of Financial Results for the Quarter & Nine Months ended 31st December, 2022 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the website of the Stock Exchange(s). BSE: www.bseindia.com and the Company's website: www.anandrayons.com. For, ANAND RAYONS LIMITED

Place: Surat Anand Bakshi Date: 06/02/2023 Chairman

Chaitanva India Fin Credit Private Limited CIN: U67190KA2009PTC049494

B' Block, 8th Floor, Brigade Software Park, 27th Cross Rd, Banashankari Stage II, Bangalore, Karnataka - 560070 Extract of Audited Financial Results for the quarter ended December 31, 2022 [Regulation 52(8), read with regulation 52(4) of the Listing Regulations] (All amounts in ₹ millions unless otherwise stated)

Sr.No	Particulars	Quarter ended December 31, 2022	Quarter ended December 31, 2021	Year ended March 31, 2022
1	Total Income From Operations	2,030.82	930.65	3,611.90
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	527.51	164.08	703.10
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	527.51	164.08	703.1
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	414.76	122.21	522.5
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	408.85	144.91	503.4
6	Paid up Equity Share Capital	1,451.67	1,035.00	1,035.0
7	Reserves (excluding Revaluation Reserve)	5,254.98	2,709.25	2,950.7
8	Securities Premium Account	3,473.28	2,139.95	2,139.9
9	Net worth	6,706.65	3,744.25	3,985.7
10	Outstanding Debt	29,316.64	14,550.21	20,293.5
11	Outstanding Redeemable Preference Shares	NIL	NIL	N
12	Debt Equity Ratio	4.37	3.89	5.0
13	Earnings Per Share Basic: (Rs) Diluted: (Rs)	2.86 2.86	1.18 1.18	5.0 5.0
14	Capital Redemption Reserve	NIL	NIL	N
15	Debenture Redemption Reserve	10.00	10.00	10.0

- The above audited financial results ("the Statement") of Chaitanya India Fin Credit Private Limited ("the Company") for the quarter ended December 31,2022 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on February 4, 2023 and February 6, 2023 respectively.
- Figures of the previous periods have been regrouped, wherever necessary, to make them comparable with the
- Debt Service Coverage Ratio & Interest Service Coverage Ratio are not applicable to NBFC
- The above is an extract of the detailed format of quarterly results filed with the Stock exchange(s) under Regulation 52 of the of the LODR Regulations. The full format of the guarterly financial results is available on the bsites of the Stock Exchange and the listed entity URL https://www.chaitanyaindia.in/
- For the other line items referred to in regulation 52 (4) of the LODR Regulations, pertinent disclosures have been made to the Bombay Stock Exchange and can be acessed on the URL-https://www.bseindia.com/stock-share -price/debt-other/scripcode/959568/debt-corp-announcements/

For and on behalf of the Board of Direct Chaitanya India Fin Credit Private Limited Joint Managing Director
DIN: 01713987 February 6, 2023

Edelweiss

પરિશિષ્ટ ૪ (જુઓ નિયમ –૮ (૧) કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

ાથી, એડેલવેઇઝ એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની લીમીટેડ (ઇએઆરસી ટ્રસ્ટ એસસી–૪૪૪ ના ટ્રસ્ટી તરીકે તેની ક્ષમતામા કાર્યરત)(ઇએઆરસી/સિક્ચોર્ડ લેણદાર) નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્ચોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાચનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ના ૫૪)(સરકૈસી એક્ટ) ની કલમ ૧૩(૨)ની જોગવાઇઓ સાથે વંચાતા સિક્યોરીટી ઇન્ટરેસ્ટ(એનકોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨(નિયમો)ના નિયમ 3 સાથે વાંચન કેઠળ તારીખ ૨૧ જુલાઇ , ૨૦૨૨ ના રોજમાંગણા નોટીસ જારી કરી (૧) મેસર્સ તક્ષશીલા હાઇટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ (દેવાદાર),(૨) શ્રી કમલેશભાઇ કે ગોંડલીયા ઝને (૩) શ્રીમીતી દિપ્તિબેન ગોંડરલીયા અને (૪) શ્રી પાર્થિલ ગોંડલિયા (જામીનદારો) રાજેશક્ત્રમાર કે ગોંડલીયા (જામીનદારો) ને માંગણા નોટીસમાં જ્યાવેલ કુલ રકમ રૂા. ૫૭,૨૪,૯૬,૦૬૪/– (રૂપિયા સત્તાવન કરોડ ચોવીસ લાખ છજ્ઞુ હજાર ચોસઠ પુરા) ૩૦ જુન, ૨૦૨૨ મુજબની બાકી રકમ તેમજ કરારના દરે ચડત વ્યાજઅને તેના પરન ાન્ચ ચાર્જિસ આ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું.

દેવાદારો ઉપર જગાવેલ બાકી રકમની પરત ચકવાગી કરવામાં નિષ્કળ ગયા હોવાંથઈ દેવાદાર, જામીનદારો અને જાહેર જનતાને જાગ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ સાથે વંચાતી સરફૈસી એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે જણાવેલ સિક્ચોર્ડ મિલક્તો સાંકેતિક કબજો ૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ લઇ લીધો છે.

માસ કરીને દેવાદાર અને જામીનદારો અને જાહેર જનતાને આથી નીચે જણાવેલ સિક્યોર્ડ મિલકત સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકતે સાથેનો કોઇપણ સોદો સિક્ચોર્ડ લેણદાર એટલે કે ઇએઆરસીની રકમ રૂા. ૫૭,૨૪,૯૬,૦૬૪/– (રૂપિયા સત્તાવન કરોડ ચોવીસ લાખ છજ્ઞ હજાર ચોસઠ પુરા) ૩૦ જુન. 20૨૨ મુજબની બાકી ૨કમના ચાર્જને આદિન ૨૯ેશે. સિક્યોર્ડ એસેટો પરત મેળવવા માટે ઉપલબ્ધ સમચના સંબંધમાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮)ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

સિક્ચોર્ડ મિલકતોની વિગત

. તસુશીલા હાઇટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ અને નીલક્મલ રીચલેટર્સ અને કોમ્પલેક્ષ પ્રાઇવેટ લીમીટેડના નીચે જણાવેલ ન વહેચાચેલ કોર્મસીચલ ચૂનિટો ના તમામ

			પ્રોજેક્ટ તક્ષશીલ	ા એલેગ્ના ("	પ્રોજેક્ટ'')	
ક્રમ નં.	યુનિટ નં.	વિંગ/ટાવર	રેસિડેન્સિચલ/ કોમર્શીચલ	ફ્લોર	વેચાણપાત્ર એરિયા (ચો ફુટ)	રેરા કાર્પેટ એરિયા (ચો ફુટ)
٩	એ-૧	ટાવર-એ	કોમર્શીયલ	ગ્રાઉન્ડ	4508	६०८. स्
5	એ-૨	ટાવર-એ	કોમર્શીયલ	ગ્રાઉન્ડ	૧૨૫૩	६७ १.३४
3	એ−3	ટાવર-એ	કોમર્શીયલ	ગ્રાઉન્ડ	9336	૭૪૫.૬૨
8	એ-૪	ટાવર-એ	કોમર્શીયલ	ગ્રાઉન્ડ	ঀ৾৾ঀয়৹	08.800
ч	એ–૫	ટાવર-એ	કોમર્શીયલ	ગ્રાઉન્ડ	9889	600.63
ξ	એ-૧૦૧	ટાવર–એ	કોમર્શીયલ	પહેલો	394८	१७७२.०६
9	એ-૧૦૨	ટાવર-એ	કોમર્શીયલ	પહેલો	9083	чсо.ез
C	એ-૧૦૩	ટાવર-એ	કોમર્શીયલ	પહેલો	୧୧୬୬	દ્ર૫૫.૫૨
e	એ-૧૦૪	ટાવર–એ	કોમર્શીયલ	પહેલો	૧૨૯૫	૭૨૫.૨૭
٩o	એ–૧૦૫	ટાવર-એ	કોમર્શીયલ	પહેલો	ঀ৾৾ঀয়৹	ሪሄξ.ξϾ
99	એ-૨૦૧	ટાવર-એ	કોમર્શીયલ	બીજો	3946	१७७२.०६
૧૨	એ-૨૦૨	ટાવર-એ	કોમર્શીયલ	બીજો	4083	4Co.G3
93	એ–૨૦૩	ટાવર–એ	કોમર્શીયલ	બીજો	99.99	દ્દપપ.પર
৭४	એ–૨૦૪	ટાવર–એ	કોમર્શીયલ	બીજો	૧૨૯૫	૭૨૫.૨૭
૧૫	એ–૨૦૫	ટાવર-એ	કોમર્શીયલ	બીજો	9480	૮૪ ξ.ξ€
٩٤	એ-3૦૧	ટાવર–એ	કોમર્શીયલ	ત્રીજો	394८	१७७२.०६
૧૭	એ-30૨	ટાવર–એ	કોમર્શીયલ	ત્રીજો	9083	4co.e3
٩८	એ–303	ટાવર-એ	કોમર્શીયલ	ત્રીજો	99.99	દ્ર૫૫.૫૨
9 E	એ-30૪	ટાવર–એ	કોમર્શીયલ	ત્રીજો	૧૨૯૫	૭૨૫.૨૭

કાઇનલ પ્લોટ નં. ૫૮૩બી +સી પૈકી ક્ષેત્રફળ ૪૦૩૧ ચો.મી., ટાઉન પ્લાનિંગ સકીમ નં. ૩/૫, અને ફાઇનલ પ્લોટનં. ૫૮૨/૧ પૈકી ક્ષેત્રફળ ૨૦૫૬ ચો.ચાર્ડ, એટલે કે ૧૭૧૯ ચો.મી., એલિસ બિર્જી ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. ૩, (રેતન્ચુ રેસેર્ડ મુજબ ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. ૩/૫), બંને ગામ/ મોજે છાડવાડ, તાલુોક સાબરમતી, (જુનો સીટી તાલુકો), જિહ્નો અમદાવાદ અને પેટા જિહ્નો અમદાવાદ-૩ (મેમનગર) ગુજરાત ખાતેની ફીહોલ્ડ બિન ખેતીલાચક જમીન પર બંધાયેલ તમામ ભાગ અને હિસ્સા તેમજ તક્ષશીલા હાઇટ્સ ઇન્ડિચા પ્રાઇવેટ લીમીટેડ, નીલકમલ રીચલેટર્સ અને કોમ્પલેક્ષ પ્રાઇવેટ લીમીટેડ અને તક્ષશીલા ડેવલોપર્સ પ્રાઇવેટ લીમીટેડની પ્રોજેક્ટ અને ચુનિટ સંબંદિત જંગમ મિલકતો તેમજ તેની મશીનરીઓ, ઉપકરણો, મશીનરી સ્પેર્સ, ટુલ્સ અને એસેસરીઝ અને અન્ય

તમામ જગમા. ૨. ફ્લેટ નં. એ-૨૪૦૧ (ચુનિટ) ક્ષેત્રફળ આશરે ૫૦૧૦ ચો.ફુટ, બિલ્ટ અપ એરિયા,૨૪મો માળ, તક્ષશીલા એરિ તરીકે જાણીતી રેસીડન્સીચલ સ્કીમમાં કુંદાનલ પ્લીટનં. ૫૬૦/એ, ૫૬૦/એ+બી, ૫૬૦/બી અને ૫૬૦/સીનો હિસ્સો ધરાવતી કુલ ૧૧૫૦૩ ચો.મી.નો ભાગ ધરાવતી ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૩/૫ને હિસ્સો બનતી, છાડવાડ ગામની હદમાં, તાલુકો સાબરમતી, ડિસ્ટ્રીક્ટ અને રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ- અમદાવાદ, ગુજરાત ખાતેના તક્ષશીલા ડેવલોપર્સ પ્રાઇવેટ લીમીટેડના તમામ ભાગ અને હિસ્સા તેમજ જણાવેલ પ્રોજેક્ટની જમીનમાં ન વહેચાચેલ હિસ્સો.

અધિકૃત અધિકાર્ર એડેલવેઇઝ એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની લીમીટેડ (ઇએઆરસી ટ્રસ્ટ એસસી–૪૪૪ ના ટ્રસ્ટી તરીકે તેના ક્ષમતામાં કાર્યરત) તારીખ: ૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ સ્થળ: અમદાવાદ

Public



DEVELOPMENT SUPPORT AGENCY OF GUJARAT An autonomous Society promoted by Tribal Development Departr Govt. of Gujarat (Phone no. 079-232-52253)

> E-Tender Notice No: VKY/2023/3049/D-SAG TENDER NOTICE

F. WIFF, TITT / -SEL- Head, Chavans

Development Support Agency of Gujarat (D-SAG) invites e-tender from Intending bidders for "Selection of a Design and Project Managment Consultant (DPMC) for deveopment of National Museum of Tribal Freedom Fighters at Garudeshwar, Rajpipla, Narmada District ww.dsag.gujarat.gov.in and www.nprocure.com.

Important Date:	
Online Bid Downloading Date & Time	Dt. 07/02/2023, by Time 12:00 hours
Pre Bid Meeting Date & Time	Dt. 16/02/2023, by Time 12:00 hours
Last Date & Time for Submission of Bids (Physical)	Dt. 01/03/2023, by Time 12:00 hours
Technical Bid Opening Date & Time	Dt. 01/03/2023, by Time 17:00 hours
Interested bidders are requested to downloa	ad the tender document from the above

Further details can be obtained from the office of Chief Executive oficer. Development Support Agency of Gujarat, 3rd Floor, Birsa Munda Bhavan, Gandhinagar, Gujarat 382010. Phone: (079) 23252253, Email: ceodsag@gujarat.gov.in

Chief Ecxecutive Officer Development Support Agency of Gujarat

INF/2418/22-23

CBCM81291120006/2223

BRUHAT BENGALURU MAHANAGARA PALIKE Office of the Executive Engineer, (Lakes-Yelahanka), Room No.308, 3rd Floor, Annex Building-3, N.R. Square, Bengaluru-560 002. No: EE/Yel-Lakes/TND-16/2022-23 Date: 06.02.2023

INVITATION FOR SHORT TERM TENDER (IFT) (Through GOK e-Procurement Portal only)

The Executive Engineer (Lakes-Yelahanka) BBMP, invites tenders from eligible Tenderers for the construction of works detailed in the table below. Ectimate Value

SI. No.	Name of the Work	of work (Rs. in Lakhs)	EMD Amount
1	Installation of Sluice Gates for Lakes in Yelahanka Zone.	500.00	Rs.7.50 Lakhs (Rs.1.00 Lakh through e-Procurement & remaining amount through Bank Guarantee (BG)

Period of Completion (including Monsoon): 11 Months

Calendar of Events: 1) Tender documents available from: 09.02.2023 onwards. 2) Pre-bid meeting will be held on 16.02.2023 at 16:00 hrs. 3) Last date and time for submission of Tenders: 24.02.2023 upto 16:00 hrs. (4) Technical Bids will be opened on: 27.02.2023 at 16:30 hrs. (5) Opening of Finance Bid: will be after approval of Technical Bid. Further details can be had from the office of the above during office hours on all working days or visit e-Procurement portal website https://eproc.karnataka.gov.in Sd/-

Executive Engineer (Lakes-Yelahanka), BBMP

Date 11-01-2023 A.SHARANAPPA ADVOCATE & Legal Advisor

Town Panchayath, Kudligi in Kudligi Taluk, Vijayanagara Disrict Mounesh Niranjan Pandya

Director of Synerzer. Solutions Plot No. 254, Road No. 1GTDC KATHEWAD, Ahamadabad, Gujarat State. Email. Synerzer.kar@gmail.com,

Respected Sir's / Madam **LEGAL NOTICE**

Under the due instructions from on behalf of my client who is chief offic represented & doing an official duty to the pattan panchayath, Kudligi Town in Kudligi Taluk Vijayanagara district I am issuing this legal notice. to you as

1). Present Chief officer submits that, predecessor's chief officer had publish daily news paper namely "Vijay Karnataka" called for the Tender grant in aid years of 2019-2020 for operation & maintenance (O&M) of Drinking water purifications units of No. 18 at various locations in the town panchayath limits of Kudligi for the period of 5 years After called-out said tender through the said paper, you had appeared he had accepted the offer & being and a highest

My client submit that, As per the terms & conditions you have accept the sad tender subject onwards you had executed an agreement for operation & maintenance (O & M) contract agreement work on 11/09/2000. In favor of my client office, after that my predecessor officer has issued and a work order dated 11/09/2020 by imposing 11 conditions order to you. After you receiving the said order you had given a security of the said operation you had given Fixed Deposit (F.D) in the State Bank of India (S.B.I) Channasandra Branch (41038) of 2,20,000/- in terms & condition for E-TDR/ e-STDR to my processor officer on for the year 5 year. After taking the said work order as per agreemen dated 11/09/2020 you had fail to discharging his work on the aggrieved by my officer has issued a notice to you on 24/11/2020, dated 13/12/2020 4th notice issued through the register post to you, My officers said notices have been came to the knowledge of you. You have paid some amount of Rs 36.296 in CC Bank DD No. 513166 dtd. 15/12/2020 & Rs 40,319 D.D No. 513165 dated 15/12/2020 through nifty. After that as per the terms & conditions of the agreement dated 11/09/2020 you had not paid complete payment of $\,$ Rs 73,062 & GES-com Bill (electricity Bill) Balance amount for you are operation &

Maintenance of water purifications 18 units RO plants. 3).My client submit that, subsequently my officer issued 4th notice to you 27/01/2021 & another notice dated 21/02/2021 you had after receiving the notice you had paid a maintenance amount of Rs. 43,030/- dated 21.03.2021 12960 paid through nifty ICC Bank totally 1,71,075 Lakhs paid for the purpose of issuing the said notice to you are liable to pay the remaining balance said amount per month of Rs 73.062/- but you have no paid in Balance amount to our office. During the course of you not maintaining the 18 Ro-Plants some of the public's have raised a complaint of Your water plant maintaining workers have no supply the bad quality of water. On the received complaint by my officer then my client issued a legal notice through the register post to you dated 17/05/2021, 21/10/2021, 30/11/2021, 04/01/2022 10/01/2022, and 05/05/2022. The said all the above 6 notices have not served to you; you have intentionally deliberately the notices have not received by you. So you have liable to pay 18 -plants & maintenance remaining balance amount of Rs. 10,93,330/-+Gescom bill (Electricity bill) amount of Rs. 23,83,319 + material damage cost & material damage cost and material stolen cost 18,37,083/totally 53,13,732/- it is you are liable to pay the said amount to my office. After that the said Balance amount from you on the said you have not recieve the said legal notices to you & you have not at all maintaining the 18 Ro-plants & you have no paid a maintenance Balance amount. As per the above agreement, you have violated the operation & maintenance (O&M) contract agreement work dated 11/09/2020. After that my client & elected body members have resolution passed. Vide resulutionorder no. 3510 dated 16/04/2021 for your executed agreement work dated 11/09/2020 was cancelled. Then my client approached & given a memorandum for aggrieved the your work report. Before the deputy commissioner at Vijayanagara the said deputy commssioner have perused the said insufficient work by you the deputy commissioner has issued a permission & vide order dated 24/06/2022 to my client. The Deputy Commissioner as per the said the order my client has cancelled the executed agreement work order then my client & his office have maintaining the said 18 Ro plants.

 It is hereby directed & called upon to you as per your executed agreement dated 11/09/2020 you are liable to pay the said 18 Ro-maintenance cost of Rs 10,93,330/- + Gescom bill (electricity Bill) balance amount of Rs 23,83,319/- as on December 2021 & material damage cost & stolen material cost of Rs. 18,37,083/- totally you should be pay the balance amount of Rs 53,13,732/- to my Client Office, within 15 days from the date of receiving this legal notice to you. You should pay the balance amount of Rs. 53,13,732/- along with should pay 24% interest to our Client Office, otherwise my Client will take a suitable to criminal & Civil action against to you in the competent court of law at you ask & risks & you also are also liable to be pay the legal notice charge of 5000/-

Please you are avoid the future consequences in the court of law Sd/- **K.Siddappa** BA. LLB True Copies Attested By Me Pattan Panchayath Notary, Kudligi

Punjab Logistics Infrastructure Limited

WALK-IN-INTERVIEW

unjab Logistics Infrastructure Ltd. (PLIL), a J.V. Company of CONCOR (Navratna PSL under Ministry of Railways), and PSWC Ltd. (Wholly Owned State Goyt, Company) has set up a Multi Model Logistics Park in Ahmedgarh, Ludhiana (Punjab). The company desirou

o hire following candidates on contract basis initially for a period of 03 years, extendable 1) Chief Financial Officer (CFO): Qualified CA with one year experience, on the onsolidated pay of Rs. 75,000/- per month for 1st year, Rs. 80,000/- p.m. for 2nd year and Rs. 85.000/- p.m. for 3rd vear.

2) Assistant Chief Financial Officer (ACFO): B.Com graduate and a C.A./CMA/ICW/ Inter both groups cleared with one year experience on the consolidated pay of Rs. 35,000/per month for 1styear, Rs. 38,500/-p.m. for 2styear and Rs. 42,000/-p.m. for 3styear, Walk-in-interviews shall be conducted on 24/02/2023 from 11:00 AM onwards at Ludhian (PB). For further details i.e. Venue, Educational Qualification, Experience, Remuneration other benefits etc., please see our website www.plil.co.in.

Tender Notice No.20 of 2022-2023

Executive Engineer, Navsari (R&B) Division, Junathana, Navsari Phone No. 02637-258041 invites online tenders for Third Party Inspection and Quality Assurance 1 Work estimated cost amounting to Rs.35.00 lacs. Tender documents downloading and online submission last date is 20/02/2023 time 18.00 p.m.. Details can be seen on web site: https://www.nprocure.com and also on Information Department web site: www.statetenders.gujarat.gov.in. INF/NAV/534/2023




ON LINE TENDERING **ROAD & BUILDING DEPARTMENT** Tender Notice No. 35 of 2022-23

In the name and on behalf of the Governor of Gujarat State, the Executive Engineer, R & B Division, Civil Lines Road, B/H Blood Bank, Godhra - 389001 Dist. PMS. Ph. No (02672) 243421 invites on line tender for One Building work in B.1 form having cost Rs.258.09 lacs from the Contractors registered in appropriate category.

The Bid document for works will be available on web site https://rnb.nprocure.com. up to Dt.27.2.23 up to 12:00 Hrs. & last date of online tender submission Dt.27.2.23 up to 18:00 Hrs. Contractor should submit to this office all bid documents by RPAD on or before from Dt.27.2.23 to 6.3.23 during office hours.

For further particulars please visit above website or contact this office during office hours.

(INF/Godhra/910/2023)



SHISH INDUSTRIES LIMITED

CIN: L25209GJ2017PLC097273

Registered Office: TP No.4, RS No.11 Paiki, 12-13 B, Paiki Plot C 1st Floor of 11, 12 Suryapur Mill Compound, Varachha Road, Surat-395006, Guiarat, India, **Telephone:** +91 261 255 0587 Website: www.shishindustries.com; Email: compliance@shishindustries.com

NOTICE OF THE EXTRA ORDINARY GENERAL MEETING OF THE COMPANY, CUT DATE AND E-VOTING

NOTICE is hereby given that, in accordance the General Circular No. 14/2020 dated April 8, 2020, the General Circular No. 17/2020 dated April 13, 2020 and the General Circular No. 11/2022 dated December 28, 2022 (hereinafter collectively referred to as "MCA Circulars") issued by Ministry of Corporate Affairs ("MCA") for holding of Extra Ordinary General Meeting through VC or OAVM without the physical presence of Members at a common venue, the Extra Ordinary General Meeting (EOGM) of the Members of Shish Industries Limited will be held on Tuesday, February 28, 2023 at 11.00 a.m. IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the Special Businesses as set out in the notice of EOGM. In accordance with the above mentioned MCA Circulars and SEBI Circular No.

SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022, the Notice of EOGM is being sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company / Depositories as on Friday, February3, 2023. Member may note that Notice has been uploaded on the website of the Company at www.shishindustries.com, website of BSE Limited at www.bseindia.com and website of National Securities Depository Limited (NSDL) i.e. www.evoting.nsdl.com.

In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice EOGM could not be serviced, may temporarily get their e-mail addresses registered with the Company where (1) in case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (selfattested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to compliance@shishindustries.com; (2) in case shares mode, please provide DPID-CLID (16 digit DPID digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (selfattested scanned copy of Aadhar Card) to compliance@shishindustries.com or (3) alternatively member may send an e-mail request to evoting@nsdl.co.in for obtaining User ID and Password by proving the details mentioned in Point (a) or (b) as the case may be.

Post successful registration of the e-mail address, the shareholder would ge soft copies of notice of EOGM and the procedure for e-voting along with the userid and the password to enable them for e-voting in respect of EOGM. In case o any queries, shareholder may write to the Company a compliance@shishindustries.com. Shareholders are requested to register, update their complete bank details and Email Ids with their Depositor Participant(s) with whom they maintain their demat accounts if shares are held in dematerialized mode by submitting the requisite documents.

There being no physical shareholders in the Company, the Register of members and share transfer books of the Company will not be closed. Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the Cut-off date i.e. Tuesday February 21, 2023, shall be entitled to avail the facility of remote e-voting as wel as e-voting system on the date of the EOGM.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 (as amended) and above mentioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and e-voting on the date of the EOGM to its Members in respect of the businesses to be transacted at the EOGM. For this purpose, the Company has entered into an agreement with NSDL fo facilitating voting through electronic means.

The remote e-voting will commence on 9:00 a.m. on Saturday, February 25 2023 and will end on 5:00 P.M. on Monday, February 27, 2023. During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that a) the remote e-voting module shall be disabled by NSDLafter the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility of e-voting shall be made available at the EOGM; and c) the members who have cast their vote by remote e-voting prior to the EOGM may also attend the EOGM but shall not be entitled to cast their vote again. Detailed procedure for remote e-voting/e voting is provided in the Notice of the Extra Ordinary General Meeting.

Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of EOGM and holding shares as on the cutoff date i.e. Tuesday, February 21, 2023, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or compliance@shishindustries.com. However, if you are already registered with NSDLfor remote e-voting then you can use your existing user ID and password for casting your vote. If you forgot your password, you can reset your password $by \ using \ ``Forgot Password" \ option \ available \ on \ www.evoting.nsdl.com.$

In case of any queries for e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send a request at evoting@nsdl.co.in. Members may also contact Mrs. VibhaKhandelwal Company Secretary and Compliance officer, at the registered office of the Company or at Email id: compliance@shishindustries.com or on +91 261 255 0587 for any further clarification

Members can attend and participate in the Extra Ordinary General Meeting through VC/OAVM facility only. The instructions for joining the Extra Ordinary General Meeting are provided in the Notice of the Extra Ordinary General Meeting. In case the shareholders/members have any queries or issues regarding participation in the EOGM, you can write an email to evoting@nsdl.co.in or Call at: - Tel: 1800 1020 990 and 1800 22 44 30. Members attending the meeting through VC/OAVM shall be counted for the purposes of reckoning the quorum under Section 103 of the Companies Act, For, Shish Industries Limited

Place: Surat Date: February 6, 2023

SatishkumarManiya Chairman and Managing Director (DIN: 02529191)

Rajkot Nagarik Sahakari Bank Ltd.

Notice R.O. & H.O.: 'Arvindbhai Maniar Nagarik Sevalay', 150' Ring Road, Nr. Raiya Circle, Rajkot. Ph. 2555555

The undersigned being the authorized officer of the Rajkot Nagarik Sahakari Bank Ltd., H.O. Rajkot under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security interest Act, 2002 Section 13(2) and in exercise of powers conferred under the Security Interes (Enforcement) Pulies, 2002 Issued a demand notices by Regd.A.D.Post to the following borrower and his Quarantors calling upon them to repay the amount mentioned in the notice, with due interest thereon within **60 days** from the date of receipt of the said notice. However for the reason whatscever, certain notices are returned undelivered. Therefore this public notice is given to the following Borrower and his Guarantors advising them to repay the dues of the banks with due interest thereon within 60 Days from the date of this notice and if they will fail to repay the same the bank will take further actions including taking possession of the securitized properties mentioned in this notice, as per the provisions of above

Name.	Loan Account No.	Name and Address	Name and Address	Interest Rate	Amount Rs.
Rolya Road Branch	NAGARIK LAGHU UDYOG VEPAR LOAN 21/717/2/2166 (SEC/4111)	"MA PRABHU" Shyam Nagar -3, Close Street, 80 Feet Read, Gandhigram, Raiya	((1) Gohel Ashokkumar Gandubhai Gandhi Nagar Street No.2, Amthiba High School, Gandhigram, Rajkot - 360007 (Gujarat) Gohel Ashokkumar Gandubhai Besuly Hair Ari IndraPrasth Apartment, Raiya Road, Rajkot - 360005 Gujarat (2) Vaghela Rekhaben Udaybhai Salya Narayan Park-2, Gandhigram, 150 Feet Ring Road, Rajkot 360003 (Gujarat)	3	(As en 28/02/2022) Principal: 9,43,700=00 Interest: 92,567=00 Charges: 00=00 Total Amount: 10,36,267=00

area apprax 99-6-0 Sq. Yards admeasuring area approx 83-03 Sq. Meter along with Construction thereon acquired vide Regd, sale deed No. I 349, Dated 14/02/2005 in the name of Sureshbhai Kanjibhai Hathod (2) All Stocks of goods, machinery turniture & fixtures, vehicles, computer etc. of

Dt. 04/02/2022, Rajkot. Authorized Officer, Rajkot Nagarik Sahakari Bank Lid., H.O., Recovery Department, Rajkot.

Transmission

Branch Nature of Facility &

Adani Transmission Limited

Registered Office: Adani Corporate House, Shantigram, Near Vaishno Devi Circle, S.G. Highway, Khodiyar, Ahmedabad 382 421, Gujarat, India Phone: 079-2555 7555 | Fax: 079-2555 7177 | Email: info@adani.com Website: www.adanitransmission.com | CIN: L40300GJ2013PLC077803

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS

Sr.	Particulars		Consolidated	(₹ in Cror
No.	Folicions	Quarter Ended 31-12-2022	Nine Months Ended 31-12-2022	Quarter Ended 31-12-2021
		(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Revenue from Operations	3,551.70	9,935.06	2,911.70
2	Profit Before Tax and deferred assets recoverable / adjustable for the period	600.32	1,052.10	401.91
3	Profit after Tax for the period (Including Non Controlling Interest)	478.07	841.00	276.67
4	Total Comprehensive Income/(Loss) for the period (Including Non Controlling Interest)	336.10	196.69	141.90
5	Profit attributable to Owners of the Company for the period	474.72	866.88	267.03
6	Total Comprehensive Income / (Loss) attributable to Owners of the Company for the period	348.43	293.17	149.64
7	Paid up Equity Share Capital (Face value of ₹ 10 each)	1,115.49	1,115.49	1,099.81
8	Basic / Diluted Earnings per Equity Share (Face Value of ₹ 10 each) after net Movement in Regulatory Deferral Balance (not annualized	4.26	7.61	1.85

		31-12-2022	31-12-2022	31-12-2021
		(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Revenue from Operations	3,551.70	9,935.06	2,911.70
2	Profit Before Tax and deferred assets recoverable / adjustable for the period	600.32	1,052.10	401.91
3	Profit after Tax for the period (Including Non Controlling Interest)	478.07	841.00	276.67
4	Total Comprehensive Income/(Loss) for the period (Including Non Controlling Interest)	336.10	196.69	141.90
5	Profit attributable to Owners of the Company for the period	474.72	866.88	267.03
6	Total Comprehensive Income / (Loss) attributable to Owners of the Company for the period	348.43	293.17	149.64
7	Paid up Equity Share Capital (Face value of ₹ 10 each)	1,115.49	1,115.49	1,099.81
8	Basic / Diluted Earnings per Equity Share (Face Value of ₹ 10 each) after net Movement in Regulatory Deferral Balance (not annualized except year end) (₹)	4.26	7.61	1.85
9	Basic / Diluted Earnings per Equity Share (Face Value of ₹ 10 each) before net Movement in Regulatory Deferral Balance (not annualized except year end) (₹)	3.92	3.89	0.44
Not	PS:	as fallows :		(₹ in Crores

	except year end) (₹)				
	Notes:				
Sr. No.	Additional information on Standalone Financial results is Particulars	Quarter Ended 31-12-2022	Nine Months Ended 31-12-2022	(₹ in Crores) Quarter Ended 31-12-2021	
_	David and Control in the	(Unaudited)	(Unaudited)	(Unaudited)	
1	Revenue from Operations	271.14	529.59	298.35	
2	Profit/(Loss) for the period before tax	99.10	114.35	(29.87)	
3	Profit/(Loss) for the period after tax	99.10	114.35	(29.87)	
4	Total Comprehensive Income / (Loss) for the period	99.10	73.76	(61.56)	
1	Debt-Equity Ratio (in times) (Total Borrowings / Total Equity)	0.23	0.23	2.10	
2	Debt Service Coverage Ratio (in times) - excluding interest on Group ICD (Net Profit after tax + Depreciation and amortisation expense + Interest Expense (excluding interest on Group ICD)) / (interest expense (excluding interest on Group ICD)+ Principal Repayments of Long Term Borrowings (excluding ICD) during the period)	89.22	1.00	0.50	
3	Debt Service Coverage Ratio (in times) (Net Profit after tax + Depreciation and amortisation expense + Interest Expense / (interest expense + Principal Repayments of Long Term Borrowings during the period)	5.92	1.00	0.51	
4	Interest Service Coverage Ratio (in times) - excluding interest on Group ICD(Net Profit after tax + Interest Expense (excluding interest on Group ICD)) / Interest Expense (excluding interest on Group ICD)	119.57	1.69	0.95	
5	Interest Service Coverage Ratio (in times) (Net Profit after tax + Interest Expense) / Interest Expense	6.66	1.10	0.56	
6	Current Ratio (in times) (Current Assets / Current Liabilities)	1.50	1.50	0.40	
7	Long term debt to working capital (in times) (Long Term Borrowings+Current Maturities of Long Term Borrowings)/(Current Assets - Current Liabilities excluding Current Maturities of Long Term Borrowings)	3.17	3.17	-10.03 *	
8	Bad debts to Account receivable ratio (Total Bad debt / Average Trade Receivables)	-	-	-	
9	Current liability ratio (in times) (Current Liabilities/ Total liabilities)	0.38	0.38	0.18	
10	Total debts to total assets (in times) (Total Borrowings/ Total Assets)	0.18	0.18	0.67	
11	Debtors turnover (in times) (Revenue from Operations/Average Trade Receivables)	1,265.23	2,302.72	27.40	
12	Inventory turnover (in times) (Net Sales / Average Inventory)	-	-	-	
13	Operating margin (%) (EBIDTA excluding Other Income/ Revenue from Operations)	-0.82%	-1.67%	-0.33%	
14	Net profit margin (%) (Profit after Tax/ Total Income)	24.30%	11.20%	-6.50%	
15	Paid-up Equity Share Capital (Face Value of ₹ 10 each)	1,115.49	1,115.49	1,099.81	
16	Reserves (excluding Revaluation Reserve)	9,155.13	9,155.13	-164.17	
17	Securities Premium Account	3,834.32	3,834.32	4.070.04	
18	Net worth (as per section 2(57) of companies act 2013) Paid up Debt Capital / Outstanding Debt	4,949.57 2,322.57	4,949.57 2,322.57	4,030.01 8,463.54	
20	(Total borrowings) Earnings per share (Face Value of ₹ 10 each)	0.89	0.85	(0.85)	
20	Basic & Diluted (not annualised except year end) (₹)	0.09	0.65	(0.65)	

*Ratio is negative since the Current Liabilities (excluding current maturities of Long term borrowings) exceed the

- The above Financial Results have been reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors at their meeting held on 6th February, 2023.
- The Statutory Auditors have carried out limited review of standalone and consolidated financial results of the Company for the Quarter and Nine Months ended on 31st December, 2022.
- The above is an extract of the detailed format of the Consolidated and Standalone Financial Results for the Quarter and Nine Months ended on 31st December, 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and $Consolidated\ Financial\ Results\ for\ the\ Quarter\ and\ Nine\ Months\ ended\ on\ 31^{st}\ December, 2022\ are\ available\ on\ the$ Stock Exchange websites, www.bseindia.com and www.nseindia.com and on the Company's website,

For & on Behalf of the Board

Gautam S. Adani

Ahmedabad

Current Assets as at December 31, 2021

www.adanitransmission.com.

Date: 6th February, 2023